



રાજકોટ મહાનગરપાલિકા
શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય
૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

ટેકનીકલ બીડ

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી લાઇબ્રેરીઓ માટે બે વર્ષ માટે જરૂરિયાત પ્રમાણે રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે ખરીદી કામનો રેઇટ કોન્ટ્રાક્ટ

- (૧) કામની વિગત : રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પુસ્તકાલયોમાં
રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાનું કામ.
- (૨) સંસ્થા(ફર્મ)નું નામ : _____
- (૩) ભાવ આપનારનું નામ : _____
- (૪) સેલ્સટેક્ષ/ટીન નંબર : _____
- (૫) શોપ એક્ટ લાઇસન્સ નંબર : _____
- (૬) સંસ્થાના પ્રતિનિધિ/પ્રોપરાઇટર\
મેનેજરનું નામ\કોન્ટેક્ટ નંબર : _____
- (૭) સરનામું : _____
- (૮) તારીખ : _____
- (૯) ટેન્ડર ફી : ૧૧૨૫/- રૂપિયા (નોન રીફંડેબલ)
ડી.ડી.નં.: _____ તારિખ _____
- (૧૦) અર્નેસ્ટમનીની રકમ : ૪૮૦૦૦/-
ડી.ડી.નં. : _____ તારિખ _____
- (૧૧) સિક્યોરીટી ડિપોઝીટ : કુલ કિમતના ૫% (ટકા) મુજબ
- (૧૨) બેંકની વિગત : બેંકનું નામ _____
: બ્રાંચ _____
: એકા.નં. _____
: એકા. ટાઇપ _____

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા

શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય

૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી લાઇબ્રેરીઓ માટે બે વર્ષ માટે જરૂરિયાત પ્રમાણે
રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાના કામ સંબંધે ટેકનીકલ બીડમાં ક્વોલીફાઇડ થવાની
શરતો

- (૧) ટેન્ડર ભરનાર રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે ના વિકેતા, પ્રોડકશન કરનાર કે વેન્ડર હોવા જરૂરી છે. જેની અધિકૃતતા સંબંધે પેઢીના સર્ટીફિકેટ કે ઓથોરાઇઝ્ડ લેટરની નકલ રજુ કરવાની રહેશે.
- (૨) સંસ્થા/પેઢીના માન્ય પુરાવા તરીકે જી.એસ.ટી. નંબર/શોપ એક્ટ લાઇસન્સ/સેલ્સ ટેક્સ પૈકી કોઇ એકની નકલ ટેન્ડર સાથે રજુ કરવાની રહેશે.
- (૩) સરકારી/અર્ધ સરકારી અથવા લીમીટેડ કંપની કે મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે સપ્લાઇ કરવાનો અનુભવ જરૂરી છે
- (૪) ટેન્ડર ભરનાર સંસ્થાનું છેલ્લા નાણાકીય વર્ષમાં ટર્નઓવર રૂપિયા ૮ લાખ કે તેથી વધુ રકમનું ધરાવતી હોવી જોઇએ. આ અંગેના માન્ય પુરાવા તરીકે સરકારી, અર્ધ સરકારી કે અન્ય સંસ્થાના કામના વર્ક ઓર્ડર/ચાર્ટર એકાઉન્ટન્ટના સર્ટીફિકેટ રજુ કરવાનાં રહેશે.
- (૫) ભાવ ભરનાર પેઢી અન્ય કોઇ સરકારી, અર્ધસરકારી કે માન્ય સંસ્થાઓ દ્વારા બ્લોક લીસ્ટ થયેલ નથી તેની ભાવ ભરનાર વેપારીએ બાહેધરી આપવાની રહેશે. આપેલ બાહેધરી ખોટી માલુમ પડ્યે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- (૬) આ કામના ટેન્ડરની ફી ૧૧૨૫/- રૂપિયા (નોન રીફંડેબલ) તેમજ અર્નેસ્ટમની પેટે રકમ રૂપિયા ૪૮૦૦૦/- ના ડીમાન્ડ ડ્રાફ્ટ ટેકનીકલ બીડમાં સામેલ રાખી તા ૨૫/૦૫/૨૦૨૨ ૧૮:૦૦ કલાક સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા, શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, ૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ/રજી.એડી થી જ મોકલવાના રહેશે. તેમજ ભાવ મંજુર થયે કુલ કામના ૫% સિક્યોરીટી રકમ ભરવાની રહેશે. ઓછા કે વધુ ભાવ મંજુર કરવાની આખરી સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે. તેમજ મુદત બાદ આવેલા ટેન્ડર સ્વીકારવામાં આવશે નહિ તેમજ શરતી ટેન્ડર રદ કરવામાં આવશે.

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા

શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય

૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

- (૭) મંજૂર થયેલ ભાવ મુજબ વધુ કે ઓછા પ્રમાણમાં ઓર્ડર મુજબ દર્શાવવામાં આવે તે રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે એફ. ઓ. આર. પુસ્તકાલય સ્થળે દિવસ પંદરમાં પુરા પાડવાના રહેશે.
- (૮) રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે સપ્લાય કરવાનો અનુભવ
- (૯) શરતી ટેન્ડર કે ટેન્ડરમાં જણાવેલ રીતથી અલગ રીતે ભરેલ કે ટેન્ડરની કોઇ શરત કે આઇટમનાં વર્ણન કે સ્પેસીફિકેશનમાં ફેરફાર કરેલું ટેન્ડર રજુ કર્યું હશે તો તે સ્વીકારવામાં આવશે નહિ.
- (૧૦) ઉપરોક્ત તમામ પ્રમાણિત પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ ટેન્ડર સાથે જોડવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી લાઇબ્રેરીઓ માટે બે વર્ષ માટે જરૂરિયાત પ્રમાણે

રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાના કામ સંબંધે સામાન્ય શરતો

૧. આ કામ અંદાજિત ૧૬ લાખનું છે. જેથી સિક્યુરિટી ડીપોઝીટ ૫% લેખે ૮૦,૦૦૦/- થશે. જે ટેન્ડરની શરત નંબર ૨૩ મુજબ પરત કરવામાં આવશે.
૨. આ કામનું કરારનામું સરકારશ્રીના નિયમ મુજબ સિક્યુરિટી ડીપોઝીટની એફ.ડી. સ્વરૂપે આપવામાં આવ્યે સિક્યુરિટી ડીપોઝીટની રકમના ૪.૯૦% લેખેની રકમના સ્ટેમ્પ પેપર ઉપર કરારનામું કરી આપવાનું રહેશે અને સિક્યુરિટી ડીપોઝીટ રોકડ સ્વરૂપમાં જમા કરાવ્યે રૂ. ૧૦૦ નાં સ્ટેમ્પ પેપર ઉપર કરારનામું કરી આપવાનું રહેશે.
૩. ચાલુ નાણાકીય વર્ષની પ્રોફેશનલ ટેક્સ ભર્યાની પહોંચની નકલ ટેન્ડર સાથે રજુ કરવી
૪. જો પેઢી પ્રોપરાઇટરશીપની હોય તો માલિકનું નામ અને જો ભાગીદારી પેઢી હોય તો તમામ ભાગીદારોના નામ અને જો પેઢી લીમિટેડ કંપનીની હોય તો તેમના મેનેજીંગ ડીરેક્ટરનું નામ, સરનામાં ફોન નંબરની વિગત સાથે આપવી તેમજ લીમિટેડ કંપનીના કિસ્સામાં મહાનગરપાલિકા સાથે કરાર કરવાની સત્તા ધરાવતા ઇસમોને જરૂરી અધિકાર પત્ર કંપની તરફથી ઇસ્યુ થયેલો હોવો જોઇએ, તેની નકલ આ સાથે આપવાની રહેશે. વિશેષમાં મહાનગરપાલિકા સાથેના વ્યવહારમાં જે આસામી સતત સંપર્કમાં રહી શકે તેના નામ, સરનામાં, ફોન નંબરની વિગતો આપવાની રહેશે.

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા

શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય

૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

- પ. આ કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે છે, એટલે કે કોન્ટ્રાક્ટનાં એગ્રીમેન્ટ થયાની તારીખથી બે વર્ષ સુધી નાં સમયગાળા માટે વર્કઓર્ડર આપી શકાશે. તેમજ આ વર્કઓર્ડરની મુદત પુરી થાય ત્યા સુધી કોન્ટ્રાક્ટનો અમલ કરવાનો રહેશે. એટલે કે કોન્ટ્રાક્ટનાં છેલ્લે દિવસે કોઈ કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવે અને તે કામની સમય મર્યાદા મુજબ તે વર્ક ઓર્ડર પુરતું કામ આજ કોન્ટ્રાક્ટની શરતો /ભાવથી કરી આપવાનું રહેશે.
૬. ટેન્ડરમાં માંગવામાં આવેલ તમામ વિગતો, માહિતી જરૂરી આધાર પુરાવા, ઝેરોક્ષ નકલો સ્વપ્રમાણિત/ગેઝેટેડ/નોટરાઇઝ કરેલ નહિ હોય તો આવું ટેન્ડર રદ કરવાને પાત્ર થશે.
૭. વેપારીએ પેઢીના એકાઉન્ટ નંબર, બેંકનું નામ તેમજ બેંકની શાખાનું સરનામાંની વિગત માટે પાસબુક/બેંક સ્ટેટમેન્ટની ઝેરોક્ષ ટેકનીકલ બીડમાં સામેલ રાખવાની રહેશે.
૮. ભાવ એફ.ઓ.આર. રાજકોટ મહાનગરપાલિકાના પુસ્તકાલય સુધી ઓર્ડર મળ્યાથી દિવસ ૧૫(પંદર) માં પુરા પાડવાનાં રહેશે. અથવા ઓર્ડર મળ્યાથી સદરહું માલ સુચવવામાં આવે તે સ્થળે પહોંચતો કરી આપવાનો રહેશે.
-
૯. આ કામે સુચવવામાં આવે તે મુદતમાં જ કામ પુરૂ કરવાનું રહેશે.
૧૦. શરતી ભાવ સ્વીકારવામાં આવશે નહીં.
૧૧. વેપારીએ ફક્ત પોતાના જ પ્રોડક્શન ઉપરના ભાવ ભરીને મોકલાવેલ હશે તો તેવા ભાવ ધ્યાને લેવામાં આવશે નહીં. પસંદ કરવામાં આવે તેવા વિવિધ કંપનીઓના કોઈપણ પ્રકારના ટોચઝ, ગેઇમ્સ, પઝલ્સ વગેરેની કિંમત ઉપર વળતર (કમિશન) ના સરેરાસ ટકા ભરવાના રહેશે.
૧૨. અર્નેસ્ટમની પેટે ભરેલ રકમ ટેન્ડરના નિરાકરણ બાદ પરત આપવામાં આવશે. અર્નેસ્ટમની ડિપોઝીટ વગરના ટેન્ડરો ખોલવામાં જ નહિ આવે.
૧૩. રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડ્યા બાદ ધોરણસર બીલ પાસ થયે બીલની રકમ ચુકવવામાં આવશે.
૧૪. મંજૂર થયેલ ભાવ મુજબ વધુ કે ઓછા પ્રમાણમાં ઓર્ડર મુજબ રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે આપવાના રહેશે.
૧૫. આ બે વર્ષ દરમ્યાન જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર પુરો કરવાનો રહેશે.

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા

શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય

૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

૧૬. ઉપરોક્ત કામના ટેન્ડર તા. ૧૧/૦૫/૨૦૨૨ થી વેબસાઇટ www.nprocure.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ઇ-ટેન્ડર તા. ૨૩/૦૫/૨૦૨૨ ૧૭.૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. આ કામે ઓન લાઇન સબમીશન તા. ૨૩/૦૫/૨૦૨૨ ૧૮.૦૦ કલાક સુધીમાં કરવાનું રહેશે. પ્રી - બીડ મીટીંગ તા. ૧૮/૦૫/૨૦૨૨ ૧૨.૦૦ કલાકે શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય ખાતે રહેશે. જો શક્ય હશે તો આ કામના ટેકનીકલ બીડ તા. ૨૬/૦૫/૨૦૨૨ ૧૧.૦૦ ખોલવામાં આવશે. ત્યાર બાદ ટેકનીકલ બીડમાં પુર્વપાત્ર થનાર આસામીઓના જ ભાવો તા. ૨૬/૦૫/૨૦૨૨ ૧૨.૦૦ કલાકે ખોલવામાં આવશે.
૧૭. ટેકનીકલ બીડ ઉપર ટેન્ડરનું નામ તથા સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય દર્શાવવાનો રહેશે.
૧૮. ઓછા ભાવનું કે હરકોઇ ટેન્ડર સ્વીકારવું કે નહિ તેનો તેમજ ઓછો વધતો માલ ખરીદવાનો હક્ક મહાનગરપાલિકા અબાધિત રાખે છે. આ અંગે કશા કારણો આપવામાં આવશે નહીં.
૧૯. મહાનગરપાલિકામાં ચાલતા ધોરણો મુજબ તથા વર્તમાનકાળે અમલમાં હોય તેવા નિયમો, પેટા નિયમો, બી.પી.એમ.સી.એક્ટની જોગવાઈઓને આધીન રહી આ ટેન્ડર ભરવામાં આવેલ છે તેમ સમજવાનું છે.
૨૦. આ કામે ભાવ મંજૂરીના ખબર મળ્યે દિવસ -૭ (સાત) માં વેપારી/સંસ્થાએ ટેન્ડરની કિંમતના ૫% (ટકા) મુજબ સિક્યોરીટી ડીપોઝીટની નેશનલાઇઝ્ડ/શેડ્યુલ્ડ બેંકની ડ્રિફ્ટ ડિપોઝીટ રસીદ કઢાવી શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય ખાતે રજૂ કરી, ધોરણસર સ્ટેમ્પ પેપર ઉપર મહાનગરપાલિકાની તરફેણમાં કરારનામું કરી આપવાનું રહેશે. એગ્રીમેન્ટ નિયમ મુજબના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું રહેશે. એગ્રીમેન્ટ માટે જેટલી કિંમતના સ્ટેમ્પ પેપર ખરીદવાના થાય તે વેપારીએ રજૂ કરવાના રહેશે. વેપારીએ એગ્રીમેન્ટ શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય વિભાગે આપેલા નમુના મુજબ ટાઇપ કરાવી રજૂ કરવાનું રહેશે.

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા

શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય

૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

૨૧. ટેન્ડર મંજૂર થયા બાદ કોઇપણ પ્રકારનો ભાવ વધારો માંગી શકાશે નહીં કે આપવાનો રહેશે નહિ.
૨૨. આ કામ બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી રહેશે, અને જે ભાવ ભરનારને બંધનકર્તા રહેશે. વિવાદ ફક્ત રાજકોટ જુરીડીકશનમાં ચાલી શકશે.
૨૩. સિક્યોરીટી ડિપોઝીટની રકમ ફાઇનલ બીલ પાસ થયે કામગીરી સંતોષકારક જણાયે ૯૦ દિવસ પછી પરત મળી શકશે અન્યથા સિક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.
૨૪. આવેલ ભાવો પરત્વે જો વાટાઘાટની જરૂરિયાત જણાય તો વાટાઘાટની પધ્ધતિ રાજકોટ મહાનગરપાલિકા નક્કી કરે તે મુજબ ભાવ ભરનારને બંધનકર્તા રહેશે. અને મંજૂર થયેલ ભાવથી વર્કઓર્ડર આપવામાં આવે તે રીતે રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી લાઇબ્રેરીઓ માટે બે વર્ષ માટે જરૂરિયાત પ્રમાણે

રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાના કામ સબંધે ટેકનીકલ સ્પેસીફિકેશન

૧. રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે સ્ટાન્ડર્ડ કંપનીના જ પુરા પાડવાનાં રહેશે.
૨. દરેક રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે મોકલતા પહેલા કાળજીપૂર્વક તપાસી લેવું જો તેમાં કોઇપણ પ્રકારની નુકશાની જણાશે કે પાછળથી રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરેમાં કોઇ નુકશાની જણાશે તો તે પાછી લઇ તેને બદલે સારા નવા રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે મોકલી આપવાના રહેશે. જે અંગેનું બંને બાજુનું નુર જે તે સસ્થા કે વિક્રેતાએ ભોગવવાનું રહેશે.
૩. રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે કિંમત ઉપર કોઇપણ પ્રકારનો ટેક્ષ કે અન્ય ચાર્જ આકારવાનો રહેશે નહીં.
૪. રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરેમાં કંપની કેટલોગ મુજબ છાપેલ કિંમત પર જ વળતર આપવાનું રહેશે. સ્ટીકર મારેલાં કે હાથથી લખાયેલા ભાવો પર વળતર માન્ય રાખવામાં આવશે નહીં.
૫. રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે બાળકોને રમવામાં તેના કલર, સેઇપ કે મટીરીયલ્સથી નુકશાન ન થાય તે પ્રકારના જ પુરા પાડવાના રહેશે.

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા
શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય
૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી લાઇબ્રેરીઓ માટે બે વર્ષ માટે જરૂરિયાત પ્રમાણે
રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે પુરા પાડવાના કામ સબંધે પેનલ્ટીની શરતો

૧. ઓર્ડરમાં સુચવ્યા મુજબનાં રમકડા, ગેઇમ્સ, પઝલ્સ વગેરે ઓર્ડર મલ્ચેથી દિવસ પંદરમાં લાઇબ્રેરી વિભાગને પહોંચતા કરવાના રહેશે. અને તે માટે કસુર થયે મુળ સપ્લાઇ ઓર્ડરના ૧૦% લેખે પેનલ્ટીની રકમ ભરપાઇ કરવાની રહેશે અથવા કમિશ્નરશ્રી જે કોઇ નુકશાની ચુકવવા હુકમ કરશે તે રકમ ચુકવવાની રહેશે.
૨. પેનલ્ટીની રકમ બીલમાંથી કપાત કરવામાં આવશે. તેમજ જરૂર જણાયે કોઇપણ જાતની નોટીસ આપ્યા વગર ભાવ રદ કરી રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ કામ માટે કાયમી ધોરણે બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે.

નાયબ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા

અમારા તરફથી ટેન્ડર ભરતી વખતે ઉપરોક્ત તમામ મુદ્દાઓની સંપૂર્ણ માહિતીથી અમો વાકેફ છીએ. આમ છતાં જો કોઇ બાબતે ચુક હશે કે ટેન્ડરમાં માંગવામાં આવેલ તમામ વિગતો/માહિતી, જરૂરી આધાર પુરાવા, નકલ ટેન્ડર સાથે જ બીડવામાં (રજૂ કરવામાં) આવેલ નહીં હોય તો અમો જાણીએ છીએ કે આવું ટેન્ડર રદ કરવાને પાત્ર થશે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નિર્ણય અમોને બંધનકર્તા રહેશે. જે અમોને કબુલ મંજૂર છે. તે બદલ નીચે સહી કરી આપેલ છે.

તારીખ :_ / / ૨૦૨૨

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____



રાજકોટ મહાનગરપાલિકા
શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય
૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટ

COMMERCIAL BID

Sr. no.	Details	Offered average Commission Percentage
1.	Discount offered all Tender Items	

નોંધ :: આ માત્ર સેમ્પલ છે. ભાવ ફક્ત ઓનલાઇન ભરવાના છે.

અમારા તરફથી ટેન્ડર ભરતી વખતે ઉપરોક્ત તમામ મુદ્દાઓની સંપૂર્ણ માહિતીથી અમો વાકેફ છીએ. આમ છતાં જો કોઈ બાબતે ચુક હશે કે ટેન્ડરમાં માંગવામાં આવેલ તમામ વિગતો / માહિતી, જરૂરી આધાર પુરાવા, નકલ ટેન્ડર સાથે જ બીડવામાં (રજુ કરવામાં) આવેલ નહિ હોય તો અમો જાણીએ છીએ કે આવું ટેન્ડર રદ કરવાને પાત્ર થશે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નિર્ણય અમોને બંધનકર્તા રહેશે. જે અમોને કબુલ મંજુર છે. તે બદલ નીચે સહી કરી આપેલ છે.

તારીખ :- / /૨૦૨૨

ભાવ આપનારની સહી. _____

ભાવ આપનારનું નામ . _____

પેઢી/સંસ્થાનો સિક્કો. _____